

પહેલા સુનામી અને હવે ગુજરાત પર “આસમાની” સુનામી..!!!

(૮૫ વરસના મુર્ધન્ય કવી ઉશનસ્ક સુનામીની આસ્તને શી રીતે મુલવે છે તે જ્ઞાંવું રસપ્રદ થશે. વાંચો:)

‘સુનામી’ ટ્રાટક્સ્યું એના હંદયવીદારક ને હચમચાવી નાખનારાં વર્ષનો સાથે એક પરમ આશ્વાસક વીશ્વવલણ ઉપસી આવ્યું એની વાત કરવા જ આ પત્ર....

વીશ્વના ઈતીહાસમાં ક્યારેય નહીં એવું માનવએકતાનું એક સંવાદી ચીત્ર ત્યારે જેવા મળ્યું. આખું વીશ્વ જાણે સાચે જ ભૂગર્ભ હોય એટલું હમદર્દ બની મદદે ધાયું. દેશવીદેશના સીમાઓ જાણે ભુંસાઈ ગયા! ધર્મ અને રાજકારણના મતભેદો પણ જાણે ઓગળી ગયા. આપણે ત્યાં કહેવાયું છે તેમ ‘વીશ્વ એક નીડ’ બની ગયું! માનવજાત આટલી નીકટ ક્યારેય આ પુર્વે આવી ન હતી. કેવું પરમ આશ્વાસક ચીત્ર આ!

વીજ્ઞાને બીજું વીશ્વયુદ્ધ મહાવીનાશક રીતે આટોપી લીધું હતું. ત્યારે આપણે વીજ્ઞાને ઘણી ગાળો દીધી હતી પણ એ જ વીજ્ઞાન એકવીસમી સદીમાં પરમ પ્રેમ લઈને જાણે આવ્યું છે. ઈલેક્ટ્રોનીક મીડીયાને કારણે કચ્છના ધરતીકંપ પછી સુનામીની વીકરાળતાની વાત વીશ્વભરમાં તરત જ ફેલાઈ ગઈ. આપણા પ્રબંધન-ડિજાસ્ટર મેનેજમેન્ટ-જેવાં શાસકીય તંત્રો યોજનાબદ્ધ રીતે કામે લાગી ગયાં. પરસ્પર સહકારીતાથી જોડાઈને, કશુંય વેહજાય નહીં એમ. વીજ્ઞાનપ્રધાન યુગ છે તેનો પણ પુરો લાભ લેવાયો, અમેરિકા જેવી સત્તાએ પાંચ દીવસનો શોક જાહેર કર્યો, યુનો પણ વહારે ધાયું. આપણા પુર્વના રહસ્યવાદી વીચારકો કહે છે તેમ કોઈ સુક્ષ્મ રીતે જગત બદલાઈ રહ્યું છે. જગતની એકતા તરફ ઘણાં બધાં વીધ્યો વચ્ચે આમ કાંઈક સુક્ષ્મ રીતે થતું આવે છે. જીણી રીતે જોઈએ તો આધુનીક ઈતીહાસમાં આવાં મંગળ વલણો સપાટી પર આવતાં દેખાય છે. વીસમી સદીના અંતે આપણે જોઈ શક્યા કે, યુદ્ધ વખતે વીમક્ત થયેલા દેશો એક થવા માગે છે, ક્યાંક થયા પણ છે. રાજશાહી, એકાધીકારવાદ, લશ્કરવાદ, ધાર્મિક રાજ્યો અપ્રસ્તુત અને અપ્રતીક થવા માંજ્યાં છે. બીજી સાંપ્રદાયીક લોકશાહી તરફનું વલણ વધતું જાય છે. યુદ્ધનો માર્ગ હવે ઈલાજ તરીકે બીજાસરકારક અને વ્યર્થ ગણાતો આવે છે. જુનાં વીજેતા રાષ્ટ્રો યુદ્ધહીંસા બદલ પરાળીત રાષ્ટ્રની માર્ગી માગે છે. આ બધાં નવાં વલણો સકારાત્મક નથી?

આપણે ત્યાં પણ સામ્રદ્ધાયીકતા સામે સર્વ ધર્મોમાં વીરોધ નથી? ધર્મ, ધર્મને ઠેકાણે રાખી લોકોના ઐહીક જીવનધોરણને ઉચ્ચ લાવવા માટે જ વલણ વધતું જતું હોય એમ મને તો એકંદરે લાગે છે. ધર્મસંપ્રદાયો પણ હવે પ્રજાજીવનના ઐહીક સુખના કાર્યક્રમો તરફ ધ્યાન આપતા જોઈ શકાય છે. હવે આપણા ભાવી ચીંતનના એકમ તરીકે ‘વીશ્વ’ છે. વીશ્વથી નાનું એકમ જાણે અપ્રસ્તુત બની ગયું છે. યુનોના Days જુઓ, તો તરત જ્યાલમાં આવશે. ‘પોલીયો’ રસીકરણ દ્વારા આ રોગને વીશ્વભરમાંથી નાખું કરવાનું વલણ, ઠેર ઠેર પર્યાવરણમાં વધતો જતો રસ- દુરનું કોઈ સ્વર્ગ કે મોક્ષ નહીં; અહીં જ આપણી આ

વહાલી પૃથ્વી પર જ સુખ લાવવાનો જાણે યજ્ઞ ચાલી રહ્યો છે. ‘વીઘ્નો’ તો આવે જ, વાર પણ લાગશે; પણ સરવાળે માનવજાતે એક કુટુંબ હોય તે રીતે નજીક આવ્યા વગર છુટકો જ નથી.

---‘ઉશનસ્કુ’

લક્ષ્મી શેરી, મદનવાડ, વલસાડ-૩૮૮૫૦૦૧

(કવીનું આ આશાવાદી ચીતન બાહુ મીઠું લાગયું. આપણે પ્રાથીએ કે આર્થિક કવીનો આશાવાદ ફળતો રહે..૬..)

તા.૧: ફ: ૨૦૦૫ના ‘નયામાર્ગ’ પાક્ષિકમાંથી સાભાર

‘ઉઝા જોહણી’ અને ‘વીજયા-કલાપી’ ફેન્-ટમાં પુનર્લેખન: uttamgajjar@hotmail.com

૦૦૦

વૈશાખી બપોર ઽઉશનસ્કુ

(શીજરીણી-સાંનેટ)

બજે ભડ્કે ઉભું ભડ્કાનું લાક્ષાનું ઘર આઃ
દીશાઓની ભીંતો તત્ત્વતી; ઈટેઈટ દ્વતી,
ચણોલી તે લાવા રસ થઈ થઈ ઓગળી જતી,
દ્વે છે સીસાશી ગાજન છત માથા ઉપર આ.

બજે તડ્કા ભડ્કે, પવન પણ ચંપાય થઈ લુ
પથે ઉંડે આંધી રણ સરખી રેતી કણકણે.
જગારા મારે શું અખીલ રવી પ્રત્યેક કિરણે!
ગણાતી સંગાથી નીતની, ગઈ છાયાય છુ.

બધું જે ઉભું છે ગતીહીન, બજે ત્યાં જ ભડ્કે,
બીચારું ઉભું ભું, તસુ પણ ખસી એ નવ શકે.
વહે જે લાવા સરખું રગાજામાં, ન ખબ્કે,
જવું ક્યાં? છાયાયે ખદ્ધખદ થતી, કોણ અહકે?

નીડે પાંખો, ચાંચો અહકી લુની આંચોથી ચુપ છે;
સમુચો સાંચો છે ઠપ; ભલ્લુકતો માત્ર ધુપ છે.

--ઉશનસ્કુ--

ગુજરાત સાહીત્ય અકાદમી, અમદાવાદ પ્રકાશિત માસિક ‘શબ્દસૂચી’ ના જુન ૨૦૦૫ના અંકમાંથી સાભાર..

‘ઉઝા જોહણી’ અને ‘વીજયા-કલાપી’ ફેન્-ટમાં પુનર્લેખન:

uttamgajjar@hotmail.com

